



સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા)

ઈસરોની સામે, સેટેલાઈટ, અમદાવાદ- ૩૮૦૦૧૫

ફોન નં.: (૦૭૯) ૨૬૯૧ ૯૯૦૦ ફેક્સ નં.: (૦૭૯) ૨૬૯૧ ૯૯૪૫

www.spipa.gujarat.gov.in

યુપીએસસી સિવિલ સર્વિસીઝ સાક્ષાત્કાર કસોટી જોગ

સ્પીપા, અમદાવાદ ખાતે યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ સ્ટડી સેન્ટર દ્વારા યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ મુખ્ય પરીક્ષા ૨૦૨૦ માં સફળ થયેલા ઉમેદવારો માટે સીવીલ સર્વિસીઝ (IAS, IPS, IFS etc.) ની પર્સનાલિટી ટેસ્ટ (ઈન્ટરવ્યુ) માટેની તૈયારી સાડ તાલીમવર્ગ વિનામૂલ્યે શરૂ કરવામાં આવનાર છે. ઉમેદવારે રીફ્રેશબલ ડીપોઝીટ પેટે રૂ.૩૨૦૦/- સંસ્થા ખાતે ચૂકવવાના રહેશે. સંસ્થા ખાતે લાયબ્રેરી, રીડીંગરૂમ સવલત વિનામૂલ્યે આપવામાં આવશે.

યુપીએસસી સીવીલ સર્વિસીઝ મુખ્ય પરીક્ષા ૨૦૨૦ પાસ કરેલ તેમજ યુ.પી.એસ.સી. દ્વારા લેવાનાર પર્સનાલિટી ટેસ્ટ (ઈન્ટરવ્યુ) માટે ક્વોલિફાય થયેલ સફળ ઉમેદવારો જો સ્પીપા દ્વારા આપવામાં આવનાર ઈન્ટરવ્યુ અંગેની તાલીમનો અને સરકારશ્રી દ્વારા નિયત થયેલ પ્રોત્સાહન સહાયનો લાભ લેવા ઈચ્છતા હોય તો તેઓએ spipa.upsc@gmail.com પર ઈન્ટરવ્યુ તાલીમવર્ગમાં જોડાવવા માટેની પોતાની અરજી અને DAF (Detailed Application Form) ઈ-મેઈલ મારફત મોકલી આપવાની રહેશે.

યુ.પી.એસ.સી. મુખ્ય પરીક્ષા ૨૦૨૦ માં સફળ થયેલ તમામ ઉમેદવારોને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર પ્રોત્સાહન સહાય પણ આપવામાં આવશે. (પુરૂષ ઉમેદવારોને રૂ.૨૫,૦૦૦/- અને મહિલા ઉમેદવારોને રૂ.૩૦,૦૦૦/-). સંબંધિત લાભાર્થીઓએ <https://digitalgujarat.gov.in/> પર Student Corner – Scholarship માં જઈ, Search online services માં Mains લખીને GO પર ક્લિક કરવાથી “For Candidates who have cleared Mains Examination of Civil Services Examination conducted by UPSC & selected for Personality Test” યોજનાના નામ પર ક્લિક કરવાથી Instruction મેનુ ખુલશે તેમાં Apply Online પર ક્લિક કરવાથી Citizen login માટેની નવી વિડોમાં Click For New Registration (For Citizen) પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, તે કર્યા બાદ Citizen login માં login થઈ, ઓનલાઈન અરજી તથા જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન અરજી તા.૦૧/૦૪/૨૦૨૧ થી તા.૨૦/૦૪/૨૦૨૧ સુધીમાં (રાત્રે ૨૩.૫૯ કલાક સુધીમાં) કરવાની રહેશે. ત્યારબાદ સ્ટાર્ટપેન્ડ અંગેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. તા.૨૦/૦૪/૨૦૨૧ બાદ કોઈ ઉમેદવારની રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.

sd/-

સંયુક્ત નિયામક(સ્ટડી)

સ્પીપા, અમદાવાદ.

ક્રમાંક: સીસપ-તાલીમ/૨૦૨૦-૨૧/ઈન્ટરવ્યુ-૨૦૨૦/સ્ટડી

સંયુક્ત નિયામક(સ્ટડી)

સ્પીપા, અમદાવાદ.